


- ૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)
- ૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત સ્કુલોમાં અવરેનસ કાર્યક્રમ



લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નવસારી

E-Mail add :- lcb-sp-nav@gujarat.gov.in

ટેલીફોન નંબર. ૦૨૬૩૭ ૨૪૭૫૦૮

પ્રેસ નોટ તા.૧૬/૧૧/૨૦૧૬

ચીખલી પો.સ્ટેમાં પ્રોહીબીશનના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી
એલ.સી.બી. નવસારી

અત્રેના નવસારી જીલ્લામાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પંચાલ એલ.સી.બી નવસારી નાઓને જરૂરી સુચના આપેલ.

જે અન્વયે તા.૧૬/૧૧/૨૦૧૬ ના રોજ હે.કો સુનીલસિંહ દેવિસિંહ, પો.કો. લલીતકુમાર અશોકભાઈ તથા પો.કો. ધવલભાઈ દેવદાનભાઈ એલ.સી.બી નવસારીનાઓ ચીખલી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. લલીતકુમાર અશોકભાઈ તથા પો.કો. ધવલભાઈ દેવદાનભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, ચીખલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી મિલન ભરતભાઈ પટેલ રહે. ચરીગામ, આંબાવાડી ફળીયુ, તા.ખેરગામ જી.નવસારીનાનો થાલા, શિવકૃપા હોટલ પાસે આવેલ છે. જે બાતમી હકીકત આધારે આરોપીની તપાસ કરતા મળી આવતા ચીખલી પો.સ્ટે.માં તપાસ કરતા આરોપી મિલન ભરતભાઈ પટેલ રહે. ચરીગામ, આંબાવાડી ફળીયુ, તા.ખેરગામ જી.નવસારી નાનો ચીખલી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૨૨૦/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૧૧૬(૨), ૮૧ મુજબના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાય આવેલ. જેથી સદર આરોપીને સીઆરપીસી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની તપાસ માટે ચીખલી પો.સ્ટેને સોંપેલ છે.





મુદા નંબર (૧)

1. જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ [http:// trackthemissingchild.gov.in/ missing/ index.php](http://trackthemissingchild.gov.in/missing/index.php) ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી ડુરલ, જલ્લાલપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો કરવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન-૨ નવસારી ડુરલ- ૧૬, ચીખલી-૩૭, બીલીમોરા - ૨૩, ઉમરાટ, - ૮, દાંડી-૨ કેમેરા સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્યાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
- નેશનલ હાઇવે નંબર ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન કક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો ગોઠવવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ ટ્રાફિક નિયમ, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીક્યુરીટી સીસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.